



### લેંગ્વેજ એકેડેમી પ્રોગ્રામ પાસેથી તમે શું અપેક્ષા રાખો છો?

૧. વિદ્યાર્થીઓ સામાજિક ઈંગ્લિશ કૌશલ્યનો વિકાસ અને સુધારો કરશે.
૨. વિદ્યાર્થીઓ શૈક્ષણિક ઈંગ્લિશ કૌશલ્યનો વિકાસ અને સુધારો કરશે.
૩. વિદ્યાર્થીઓ મેથ, સાયન્સ, અને સોશિયલ સાયન્સ વિષયવસ્તુ ના, જ્ઞાન અને કૌશલ્યમાં વિકાસ અને સુધારો કરશે.

### જે વિદ્યાર્થીઓ લેંગ્વેજ એકેડેમીમાં ભાગ લે તેમને શું લાભો થશે ?

૧. વિદ્યાર્થીઓ સર્વગ્રાહી અને ખાસ ભાષા સૂચના સ્તરનો અનુભવ કરશે અને પ્રત્યેક વિદ્યાર્થીની અનન્ય પ્રતિભાની મહત્તમતા દ્વારા તેમના ઈંગ્લિશ ભાષા શીખવાને ઝડપી બનાવવા માટે સહકાર આપશે.
૨. વિદ્યાર્થીઓને ઈંગ્લિશ અને વિષયવસ્તુ ક્ષેત્રના વર્ગો માં અત્યંત પ્રશિક્ષિત શિક્ષકો પાસેથી અદ્યતન ભાષા સંપાદન તાલીમ સાથે ગુણવત્તા સભર સૂચનાનો લાભ થશે.
૩. વિદ્યાર્થીઓની બોલી, લેખન, શ્રવણ અને વાંચન ક્ષેત્રોમાં ઈંગ્લિશ સાક્ષરતામાં સુધારો થશે.
૪. વિદ્યાર્થીઓને તેમની મૂળ ભાષાના પ્રોત્સાહનથી લાભ થશે.
૫. વિદ્યાર્થીઓ ને ઈંગ્લિશ ભાષા શીખવાની અને તેમની શૈક્ષણિક સિદ્ધિ વધારે તેવા સંબંધ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવશે.
૬. કાર્યક્રમ માર્ગદર્શક કાઉન્સેલર અને ઘર શાળા માર્ગદર્શક કાઉન્સેલર બંને ના સહકાર દ્વારા વિદ્યાર્થીઓને લાભ થશે.
૭. વિદ્યાર્થીઓ તેમની ઘર શાળા અને લેંગ્વેજ એકેડેમીના વિદ્યાર્થીઓ સાથે ગુણવત્તાસભર મિત્રતાનો વિકાસ કરશે.
૮. વિદ્યાર્થી શૈક્ષણિક કાર્યક્રમની કાળજીપૂર્વક દેખરેખ રાખવામાં આવશે.

### લેંગ્વેજ એકેડેમી કેવી રીતે કાર્ય કરે છે?

૧. બધા ઈંગ્લિશ ભાષા શીખનારાઓ અથવા મર્યાદિત શૈક્ષણિક ઈંગ્લિશ કુશળતા ધરાવતા વિદ્યાર્થીઓ દરરોજ ૧-૪ પિરિયડ ક્રિસ્ટલ લેક સેન્ટ્રલ હાઈ સ્કુલ સ્થિત ડીવિઝન લેંગ્વેજ એકેડેમીમાં હાજરી આપશે.
૨. વિદ્યાર્થીઓ દરરોજ ૬-૮ પિરિયડ દરમિયાન તેમની ઘર શાળાના વર્ગોમાં હાજરી આપશે.
૩. વિદ્યાર્થીઓએ આ ઝડપી ઈંગ્લિશ ભાષા પ્રોગ્રામ માં તે સમય સુધી સહભાગી થવું આવશ્યક છે કે વિદ્યાર્થીઓ ઈલિનોઈસ રાજ્યની આવશ્યક ACCESS( એસેસમેન્ટ ઓફ ઈંગ્લિશ લેંગ્વેજ પ્રોફિસિયન્સી) કસોટી પાસ કરે. આ મૂલ્યાંકન દર વર્ષે ફેબ્રુઆરીમાં આપવામાં આવે છે.
૪. વિદ્યાર્થીઓ રમતગમત અને અભ્યાસ પૂરક પ્રવૃત્તિઓમાં તેમની ઘર શાળામાં ભાગ લેશે.

## મારુ બાળક ક્રિસ્ટલ લેક સેન્ટ્રલ હાઈ સ્કુલમાં કઈ રીતે આવી શકે?

વિદ્યાર્થીઓને તેમના નિયમિત/ નિયુક્ત બસ સ્ટોપ ઉપરથી લેવામાં આવશે અને દરરોજ ક્રિસ્ટલ લેક સેન્ટ્રલ હાઈ સ્કુલ સીધાજ લઈ જવામાં આવશે. ૪ પિરિયડ પછી, વિદ્યાર્થીઓને તેમની ઘર શાળા ઉપર લઈ જવામાં આવશે, જ્યાં તેઓ લંચ કરી શાળાના દિવસના અંત સુધી વર્ગોમાં હાજરી આપશે.

## મારુ બાળક બસ ચુકી જાય તો શુ?

તે મહત્વપૂર્ણ છે કે તમારુ બાળક સવારમાં તૈયાર અને સમયસર હોય. જો તે/તેણી કોઈ કારણસર, મોડા ઉઠે અથવા, બસ ચુકી જાય તો, તેમને ક્રિસ્ટલ લેક સેન્ટ્રલ હાઈ સ્કુલ પહોચાડવાની તમારે જરૂર પડશે.

પ્રત્યેક દિવસે સમયસર બસ મેળવવા દ્વારા શૈક્ષણિક સફળતાની શરુઆત થશે!

જો વિદ્યાર્થી વર્ગમાં મોડો થાય, તો તે/તેણીને ધીમું ચિહ્નિત કરવામાં આવશે. આપેલ વર્ગમાં ત્રીજી વખત ધીમું ચિહ્ન મેળવ્યા પછી, વિદ્યાર્થીને તેની/તેણીની ઘર શાળામાં અટકાવવામાં આવશે.

## મોડા- શરુ સોમવારોએ શુ થશે?

શાળાના વર્ષ દરમ્યાન પ્રત્યેક સોમવારે, વિદ્યાર્થી સામાન્ય સમયે(૭:૦૦ સવારે) આવશે અને એક કલાક માર્ગદર્શન અભ્યાસ હોલ મળશે. આ સમય દરમ્યાન તેમને સંપૂર્ણ ઘરકામ પૂર્ણ કરવાની તક મળશે, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો વોપરાશ કરી શકશે, અને શિક્ષકો જે મદદ માટે પ્રાપ્ય હશે તેમની સાથે કામ કરી શકશે. ત્યાં લેંગ્વેજ એકેડેમીના વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત કામ કરવા પીઅર ટ્યુટર પણ પ્રાપ્ય હશે. વધુમાં, સોમવારના આ સમયનો ઉપયોગ માફ કરેલ ગેરહાજરીને કારણે છુટી ગયેલી કસોટીઓ, કવીઝીસ, અથવા અન્ય મુલ્યાંકનો માટે કરવામાં આવશે.

તમામ વિદ્યાર્થીઓ માટે ભાષા એકેડેમી માં અભ્યાસ હોલમાં હાજરી આવશ્યક છે.

## જો મારુ બાળક બિમાર હોય અથવા શાળામાં હાજરી ના આપી શકે તો શુ?

પ્રત્યેક સમેસ્ટરમાં, તમારા વિદ્યાર્થીને ૬ માફ કરેલ ગેરહાજરી મંજૂર કરવામાં આવશે. ગેરહાજરી માફ કરવા માટે, તમારે ઘર શાળામાં(નીચે જુઓ)કોલ કરી, અને વિદ્યાર્થી વર્ગમાં હાજર નહીં રહે તેની જાણ કરવી પડશે.

### ક્રિસ્ટલ લેક સેન્ટ્રલ



એટેન્ડન્સ હાટલાઈન:

૮૧૫-૪૫૫-૮૫૦૭

### ક્રેરી ગ્રુવ



એટેન્ડન્સ હાટલાઈન:

૮૪૭-૪૭૪-૬૧૦૦

### ક્રિસ્ટલ લેક સાઉથ



એટેન્ડન્સ હાટલાઈન:

૮૧૫-૮૮૩-૫૨૭૦

### પ્રેઈરિ રિડ્જ



એટેન્ડન્સ હાટલાઈન:

૮૧૫-૮૮૩-૫૬૦૦

## મારે અન્ય શું જાણવું જરૂરી છે?

- વિદ્યાર્થી તેમની ઘર શાળામાં લોકર મેળવશે અને ક્રિસ્ટલ લેક સેન્ટ્રલ હાઈ સ્કુલ ઉપર લેંગ્વેજ એકેડેમી લોકર મેળવશે.
- લેંગ્વેજ એકેડેમી વર્ગોમાંથી લઘુત્તમ ઘરકામ આપવામાં આવશે; જેથી તમારા વિદ્યાર્થીને તેના ઘર શાળામાંના કોર્સ માટે કામ કરવા સમય મળી રહેશે.
- વર્ગમાં સમયસર આવીને અને વર્ગમાં યોગ્ય વર્તન કરવાથી શાળા વર્ષના પ્રત્યેક ક્વાર્ટર માટે પારિતોષિકો મેળવવાની વિદ્યાર્થીને તક મળશે. જે વિદ્યાર્થીઓ શિસ્ત ભલામણો અથવા વધુ માત્રામાં મંદતા મેળવશે નહીં તેમને ક્ષેત્ર ટ્રીપ્સ, પારિતોષિકો અને વધુ, કરવાની પરવાનગી આપવામાં આવશે!
- 

## પ્રશ્નો સાથે હું કોને મળી શકું?

મિસીસ. સારા હુસેર (Sara Huser), પ્રોગ્રામ ડેસીલીટ્ટર, ને પ્રશ્નો સાથે સંપર્ક કરો.

[shuser@d155.org](mailto:shuser@d155.org) અથવા ૮૧૫-૪૫૮-૨૫૦૫ એક્સટે: ૨૨૩૮